

28 જૂન 2018

## સીટી દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવા લીધેલાં પગલાં

બ્રેમ્પટન, ઓન્ટારિયો – બ્રેમ્પટન સીટી કાઉન્સિલની બુધવારે, જુન 27ના રોજ થયેલ સભામાં કર્મચારીઓની ભલામણ પર મંજૂરીની મહોર લગાવી કે તમામ નવી સાઇટ, મુસદ્દા, અને બ્લોક પ્લાન ડેવેલપમેન્ટની અરજીઓએ ઓછામાં ઓછી સીટીની સસ્ટેનેબલ કમ્યુનિટી ડેવેલપમેન્ટ ગાઇડલાઇન્સ દ્વારા વિશિષ્ટપણે જણાવેલ બ્રોન્ઝ થ્રેસહોલ્સ સસ્ટેનેબિલિટી સ્કોર હાંસલ કરવાનો રહેશે.

ટકાઉ સમુદાયોના આયોજન અને રચના માટે સીટી ઓફ બ્રેમ્પટન એક વ્યાપક અભિગમ અપનાવે છે. સસ્ટેનેબલ કમ્યુનિટી ડેવેલપમેન્ટ ગાઇડલાઇન્સ અને સસ્ટેનેબિલિટી અસેસમેન્ટ ટૂલ એવા બે સાધનો છે જેની રચના નવા વિકાસ એપ્લિકેશનોની પર્યાવરણીય ટકાઉક્ષમતાની કામગીરી માપવા માટે થઈ છે.

સસ્ટેનેબલ કમ્યુનિટી ડેવેલપમેન્ટ ગાઇડલાઇન્સ સીટી ડેવેલપમેન્ટ ડિઝાઇન ગાઇડલાઇન્સના ભાગરૂપે થઈ છે. નવા સમુદાયો અને મકાનોના વિકાસ અને આયોજનના માર્ગદર્શન માટે ગુણાત્મક પગલા પ્રસ્થાપિત કરે છે જે દુર્યમ અને બ્લોક આયોજનના મૂલ્યાંકન અને સમીક્ષા, ઉપવિભાજન અને સાઇટ આયોજનોનો અવિભાજ્ય ભાગ બને છે.

સીટી ઓફ બ્રેમ્પટનના સસ્ટેનેબલ કમ્યુનિટી ડેવેલપમેન્ટ ગાઇડલાઇન્સ દસ્તાવેજ ઉપરાંત સીટી ઓફ વોન અને ટાઉન ઓફ રિચમન્ડ હિલ સાથે સંયુક્તપણે સસ્ટેનેબિલિટી અસેસમેન્ટ ટૂલનો વિકાસ કરવામાં આવ્યો જેમાં વિકાસના નવા એપ્લિકેશનોની પર્યાવરણીય ટકાઉક્ષમતાની કામગીરીનું ગુણાંકન અને મૂલ્યાંકન કરવાના મેટ્રિક્સ અને લક્ષ્યો સમાયેલ છે. 50 કરતા વધુ ટકાઉક્ષમતાના મેટ્રિક્સ સાથે બ્રેમ્પટનના વિકાસકર્તાઓ પાસે બ્રેમ્પટનની બ્રોન્ઝ થ્રેસહોલ્સ હાંસલ કરવા માટે વિકલ્પોની આખી શ્રેણી છે. નવી જરૂરિયાત બ્રોન્ઝ થ્રેસહોલ્સ હાંસલ કરવા માટે, સાઇટ પ્લાન વિકાસ એપ્લિકેશનોએ 35 થી 52 પોઇન્ટ્સ, મુસદ્દાના પ્લાન્સ 29 થી 39 પોઇન્ટ્સ અને બ્લોક પ્લાન્સ 30 થી 38 પોઇન્ટ્સ હાંસલ કરવાના રહેશે.

બ્રેમ્પટન 2040 વિઝનની અતિમહત્ત્વપૂર્ણ થીમ એટલે સસ્ટેનેબિલિટી એટલેકે ટકાઉક્ષમતા. વિઝન બ્રેમ્પટન માટે એક આદર્શ સમકાલીન પરંપરા બનવા માટેનું મંચ ઊભું કરે છે જે જીવન જીવવાની ગુણવત્તા, ટકાઉક્ષમતા, સ્પર્ધાત્મકતા અને સ્થિતિસ્થાપકતા પર ભાર આપે છે અને ભવિષ્ય માટેની દિશા સૂચવે છે. 2040 તરફ જતાં, લોકો પર, આપણા ગ્રહ પર અને નફા પર લાંબા ગાળાના પ્રભાવને ધ્યાન પર લે એવા સંકલનાત્મક આયોજન અને વિકાસ મારફત સીટી ટકાઉક્ષમતા અને સ્થિતિસ્થાપકતાને અગ્રતા આપશે.

ટકાઉક્ષમતા પર વધુ માહિતી માટે અને બ્રેમ્પટન વિઝન 2040 વાંચવા માટે અહીં મુલાકાત

લો [www.brampton.ca](http://www.brampton.ca)

**ક્વોટ:**

વિકાસના એપ્લિકેશનો માટે ટકાઉક્ષમતા એટલેકે સસ્ટેનેબિલિટીના લઘુત્તમ સ્કોર હાંસલ કરવાની જરૂરિયાત રાખી સીટી વધુને વધુ ટકાઉક્ષમ વિકાસ માટે માર્ગ બનાવે છે. અમને આત્મવિશ્વાસ છે કે સમુદાય આપણા સ્થાનિક પર્યાવરણને મદદરૂપ થવા માટે આ તકનો સંપૂર્ણ લાભ લેશે અને બ્રેમ્પટન વધુને વધુ પર્યાવરણીય રીતે જવાબદાર રહી વિકાસ સાધશે અવી અમે આશા રાખીએ છીએ."

- મેયર લિન્ડા જેફી

-30-

**બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારો છે.** અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).